

માનવતા માટે પ્રેમ

શ્રીગુરુમાઈ સાથે પ્રસંગ

શ્રી મુક્તાનંદ આશ્રમમાં થયેલા આનંદમય જન્મદિવસ ૨૦૧૭ના સત્તસંગોમાંથી

શ્રીગુરુમાઈ સાથે પ્રસંગ : ૧

ગારિમા બોરવાળાકર

સન ૧૯૮૪ના ઓક્ટોબર મહિનાની આ વાત છે. બાબા મુક્તાનંદની મહાસમાધિના સન્માનમાં ગુરુદેવ સિદ્ધપીઠમાં આધ્યાત્મિક અભ્યાસો અને પવિત્ર અનુષ્ઠાનોનું આચ્યોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભાગ લેવા માટે ભારતભરથી અને પૂરા વિશ્વમાંથી હજારો સિદ્ધયોગીઓ આશ્રમમાં આવ્યા હતા. ગુરુચોકના સત્તસંગ હોલ, જેને હાલમાં હૃદયદીપ કહેવામાં આવે છે, ત્યાં સાત દિવસનું અખંડ નામસંકીર્તન સમાણ થઈ રહ્યું હતું અને યજામંડપમાં યજા પણ થઈ રહ્યો હતો.

આ મંગલમય કાર્યક્રમમાં ભાગ લેવા માટે દરરોજ બસો ભરી-ભરીને ભક્તો આવી રહ્યા હતા. આ બધાં ભક્તોને રહેવા માટે, આશ્રમના મુખ્ય દ્વારની સામે આવેલી વિશાળ જગ્યામાં ઘણાં બધાં તંબૂઓ બાંધવામાં આવ્યા હતા. આ જગ્યાને ચિત્રકૂટ કહેતા હતા. ચિત્રકૂટમાં ઘણાં બધાં તંબૂઓ હતા અને સૌથી મોટા તંબૂમાં લગભગ બસો ભક્તો રહી શકતા હતા.

ગુરુચોકમાં થઈ રહેલાં નામસંકીર્તન સમાણનો આનંદમય ધ્વનિ રાત-દિવસ આખા વાતાવરણમાં વ્યાપ હતો. એક દિવસ મોડી રાતે, જ્યારે મોટાંભાગનાં લોકો સૂવા જતાં રહ્યાં હતાં, હું અને બીજા કેટલાં સેવાકર્તાઓ હજપણ આવાસનિવાસની ઓફિસમાં સંકીર્તન સાંભળતાં-સાંભળતાં અમારું કાર્ય પૂરું કરી રહ્યા હતા. અચાનક જ અમે વરસાદનો ઝરમર-ઝરમર અવાજ સાંભળ્યો. અમે આશ્ર્વર્યચક્રિત થઈને એકબીજાની સામે જોવાં લાગ્યાં. ચોમાસું ઘણાં અઠવાડિયા પહેલાં જ પૂરું થઈ ગયું હતું — અથવા અમને એવું લાગતું હતું. અમે હોડીને બાલ્કનીમાં જોવા ગયા, એ આશા સાથે કે કદાચ એ ઝરમર થોડીવાર માટે જ હતી, પણ એ જોઈને અમે નિરાશ થઈ ગયા કે તે ઝરમર વરસાદ હવે એકધારો વરસી રહ્યો હતો અને દરેક મિનિટે વધી રહ્યો હતો. અમને ચિંતા થવા લાગી કારણ કે સેંકડો લોકો તંબૂમાં સૂર્ય રહ્યાં હતાં. અમે સમજી ગયાં કે જલ્દીથી એ બધાં લોકોને ત્યાંથી બહાર કાઢીને બીજી જગ્યાએ લઈ જવા પડશે કારણ કે એ તંબૂઓ વોટરપ્રૂફ નહોતા. અમે એ પણ લાગ્યું કે આ કરવા માટે અમને ઘણાં બધા સેવાકર્તાઓની મદદની જરૂર પડશે અને આ બધું તરત જ કરવું પડશે!

જ્યારે અમે આ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે ગુરુમાઈજી આવાસનિવાસ ઓફિસમાં આવ્યાં. તેમણે કહ્યું, “આપણે ચિત્રકૂટમાં રહેતાં બધાં લોકોની રહેવાની વ્યવસ્થા બીજી જગ્યાએ કરવી પડશે.” ગુરુમાઈજીએ એક સેવાકર્તાને કહ્યું કે તે ગુરુચોકમાં જઈને જેટલાં પણ લોકો મળે તે બધાંને મદદ કરવા માટે બોલાવી લાવે.

તરત જ, અમે કામ શરૂ કરી દીધું. જેમ-જેમ લોકોને આના વિશે જાણ થતી ગઈ, વધુને વધુ લોકો મદદ માટે આવવા લાગ્યા. ગુરુમાઈજી સ્વયં લોકોને જુદાં-જુદાં કાર્યો કરવા માટે નિર્દેશ આપી રહ્યાં હતાં. કેટલાંક લોકો ચિત્રકૂટ ગયાં અને ત્યાં રહેતાં લોકોને તેમનો સામાન બાંધવામાં મદદ કરવાં લાગ્યાં અને બીજાં લોકો તંબૂમાંથી સૂકાં ગાદલાં લાવવા માટે ગયા. બાકીનાં બીજાં લોકો આખા આશ્રમમાં જ્યાંથી પણ મળે ત્યાંથી વધારાના ગાદલાં શોધવા માટે ગયાં.

ગુરુમાઈજીએ અમને કહ્યું કે અમે ગુરુચોકની નીચે આવેલા ઇન્ટેન્સિવ હોલમાં તેમજ મુક્તેશ્વર, સિદ્ધેશ્વર અને નિત્યેશ્વર બિલ્ડિંગની લોબીમાં ગાદલાં પાથરવાનું શરૂ કરી દઈએ. બધાં લોકો કામમાં જોડાઈ ગયાં અને જે પણ જરૂરી હતું એ કરવા લાગ્યાં. ગુરુમાઈજી સ્વયં સેવાકર્તાઓ સાથે મળીને ગાદલાં ઊઠાવી રહ્યાં હતાં અને લોબીમાં પાથરી રહ્યાં હતાં.

ચિત્રકૂટમાંથી લોકો આવવાં લાગ્યાં. સેવાકર્તાઓ તેમને તેમની નવી પથારી તરફ લઈ જઈ રહ્યાં હતાં, ત્યારે ગુરુમાઈજી સ્વયં તેમની પાસે જઈને પ્રેમથી તેમને પૂછી રહ્યાં હતાં કે શું તેઓ ઢીક છે અને શું તેમને બીજી કોઈ વસ્તુની જરૂર છે.

મેં જેયું કે લોકોની આંખોમાં આંસુ હતાં અને તેઓ કૃતજ્ઞતાપૂર્વક માથું નમાવીને ગુરુમાઈજીને પ્રણામ કરી રહ્યાં હતાં. લોકોએ જેયું કે તેમનાં પરમ પ્રિય શ્રીગુરુ તેમને માટે ગાદલાં ઊપાડી રહ્યાં છે, ગાદલાં પાથરી રહ્યાં છે અને અડધી રાત્રે પણ એ વાતની કાળજી રાખી રહ્યાં છે કે તેઓ ઢીક છે, આ જોઈને તેમનું હૃદય ભરાઈ આવ્યું. એ બહું સ્પષ્ટ હતું કે બધાં લોકોના હૃદયને આ સ્પર્શી ગયું, ગુરુમાઈજી તેમને કેટલો પ્રેમ કરે છે, તેમની કેટલી પરવાહ કરે છે અને સ્વયં તેમની સુખ-સુવિધાનું ધ્યાન રાખી રહ્યાં છે. ગુરુમાઈજી માટે તેમની કૃતજ્ઞતા અને ભક્તિ એટલી જ પ્રત્યક્ષ હતી જેટલો ગુરુમાઈજીનો તેમના પ્રત્યે અપાર પ્રેમ.

ચિત્રકૂટમાંથી જ્યારે છેલ્લી વ્યક્તિની રહેવાની વ્યવસ્થા અંદર થઈ ગઈ, ત્યારે ગુરુમાઈજીએ એ બધા સેવાકર્તાઓને ધન્યવાહ આપ્યાં જેમણે આખી રાત આ કાર્યમાં મદદ કરી હતી. તેમણે અમારી તરફ પ્રેમભર્યું સ્થિત કર્યું અને પ્રેમથી હાથ હલાવીને ત્યાંથી જતાં રહ્યાં.

સવાર થવામાં હતી, તેમ છતાં અમે બધાં પૂર્ણપણે સ્કૂર્ટિનો, અદ્ભુત શક્તિનો અનુભવ કરી રહ્યાં હતાં, જાણો કે અમને આખી રાત ખૂબ સરસ ઉંઘ આવી હોય. અમે અમારી ઓફિસમાં પાછા ગયા અને થોડીવાર શાંતિથી બેસીને રાતની મૃદુલતાને આત્મસાત્ર કરવા લાગ્યાં. નામસંકીર્તનનો ધ્વનિ ઓફિસ સુધી પહોંચી રહ્યો હતો, અને જેમજેમ વધારે લોકો સમાહનમાં આવવાં લાગ્યાં, તેમતેમ તે ધ્વનિ વધુ શક્તિશાળી થતો ગયો. જોકે, આખી રાત અમારાં પર પ્રેમ અને આશીર્વાદોની વર્ષા કરીને હવે વરસાદ બંધ થઈ ગયો હતો.

જ્યારે મેં પ્રત્યક્ષદ્વપે ગુરુમાઈજીને દરેક વ્યક્તિને અપાર પ્રેમ અને કરણા આપતાં જોયાં ત્યારે મને શ્રીગુરુના હૃદયની વિશાળતાની એક ઝલક મળી. આવું જ છે શ્રીગુરુનું સ્વરૂપ — ‘પ્રેમ કા સાગર’, પ્રેમનો સાગર.

શ્રીગુરુમાઈ સાથે પ્રસંગ : ૨

સ્વામી ઈશ્વરાનંદ

સન ૧૯૮૬માં શ્રીગુરુમાઈએ ભારતના ગુજરાત રાજ્યમાં ટીચિંગ યાત્રાનો આરંભ કર્યો હતો. તેમણે મોટાં શહેરોમાં, મોટા-મોટા સત્તસંગ કર્યા જેમાં હજારો ભક્તો અને શુભેચ્છકોએ ભાગ લીધો હતો. ગુરુદેવ સિદ્ધપીઠ પાછા ફરતી વખતે રસ્તામાં એક નાના ગામડામાં, ત્યાંના સિદ્ધયોગ ધ્યાન કેન્દ્રના સંચાલકોના આમંત્રણને સ્વીકારીને ગુરુમાઈજી ત્યાં સત્તસંગ કરવા માટે રોકાયાં.

એ ગામમાં બહુ થોડા સિદ્ધયોગ વિદ્યાર્થીઓ રહેતા હતા. પરંતુ જ્યારે ગુરુમાઈજીના આવવાની ખબર પહોંચી તો ગામનાં બધાં લોકો તેમનું સ્વાગત કરવા ભેગાં થઈ ગયાં.

તેમણે ગામના ચોકને તોરણો અને ફૂલોના હારથી શાશગાર્યું હતું અને શ્રીગુરુમાઈની ખુરશી ચોકમાં વરચે મૂકી હતી, જેની આસપાસ બધાં લોકોને બેસવા માટે જગ્યા હતી. ગામનાં લોકો ઘણાં બધાં નાળિયેર પણ ઉતારીને લાવ્યાં હતાં અને તેને કાપીને તૈયાર રાખ્યાં હતાં, જેથી તેઓ ગુરુમાઈજીને અને તેમની સાથે યાત્રામાં આવેલા સેવાકર્તાઓને તાજું નારિયેળ પાણી આપી શકે. ભારતમાં આહરણીય અતિથિનું સ્વાગત કરવા માટે આ એક પારંપરિક રીત છે.

ગુરુમાઈજીએ આવીને તેમનું આસન ગ્રહણ કર્યું, ત્યારે આખું ગામ તેમની આસપાસ ભેગું થઈ ગયું હતું. અત્યંત ભક્તિપૂર્વક, બે કેન્દ્ર સંચાલકો શ્રીગુરુમાઈજીનું સ્વાગત કરવા એક જ્લાસમાં નાળિયેરનું પાણી લઈને તેમને અર્પણ કરવા આગળ આવ્યા. ગુરુમાઈજીએ પ્રેમથી સ્વિમિત કર્યું અને કહ્યું, “પહેલાં મારા સ્વામીઓને નાળિયેર પાણી આપો.” કેન્દ્ર સંચાલકોએ માથું હુલાવીને હા પાડી અને ગુરુમાઈજીની ઈચ્છા પૂરી કરી.

પછી તેઓ નાળિયેર પાણીના બીજા જ્લાસ સાથે ગુરુમાઈજી પાસે આવ્યા. ગુરુમાઈજીએ કહ્યું, “પહેલાં થોડું નાળિયેર પાણી મારી સાથે યાત્રામાં આવેલા સેવાકર્તાઓને આપો જેમણે ઘણો લાંબો પ્રવાસ કર્યો છે.” બંને સંચાલકોએ હા પાડી અને ગુરુમાઈજી સાથે આવેલા દરેક સેવાકર્તાને નાળિયેરનું પાણી આપ્યું.

જ્યારે કેન્દ્ર સંચાલકો ત્રીજીવાર નાળિયેર પાણીના જ્લાસ સાથે આગળ આવ્યા, ત્યારે ગુરુમાઈજીએ તેમને કહ્યું, “ગામનાં આ લોકોએ ખૂબ જ સેવા કરી છે, તેમને તરસ લાગી હશે. એ સુનિશ્ચિત કરો કે બધાંને નાળિયેર પાણી મળે.” આ રીતે, ગામનાં બધાં લોકોને તાજાં નાળિયેરનાં મીઠાં પાણીનો જ્લાસ પીવા મળ્યો.

અંતતઃ, કેન્દ્ર સંચાલકો ગુરુમાઈજી પાસે પાછા આવ્યા અને કહ્યું, “ગુરુમાઈજી, બધાં લોકોને નાળિયેર પાણી મળી ગયું છે. હવે અમે તમને આપવા માંગીએ છીએ.”

ગુરુમાઈજીએ પ્રેમથી સ્થિત કરીને માથું હલાવીને ના પાડી. તેમણે કહ્યું, “તમે કોઈકને ભૂલી ગયા છો.” બંને કેન્દ્ર સંચાલકો મૂંજવળામાં પડી ગયા. તેઓએ આજુભાજુ જોયું અને બોલ્યા, “અમે કોને ભૂલી ગયા?” ગુરુમાઈજીએ કહ્યું, “તમે પોતાને જ ભૂલી ગયા. એક જ્લાસ નાળિયેર પાણી પી લો.” કેન્દ્ર સંચાલકોએ ગુરુમાઈજીને પ્રણામ કર્યા અને નાળિયેર પાણીને ગુરુમાઈજીનો પ્રસાદ માનીને પી ગયા.

તેમણે નાળિયેર પાણી પી લીધું, પછી ગુરુમાઈજીએ કહ્યું, “આહ, હવે જ્યારે બધાંનાં હદ્દય તૃત્ય થર્ડ ગયાં છે, તો હું પણ તૃત્ય થર્ડ ગદ્દ છું.”

એ દિવસે મને શ્રીગુરુના વિશાળ હદ્દયની એક ઝલક જોવા મળી!